



TML/BSE/NSE/2025-26/23

10th September, 2025

Listing Department,
BSE Limited,
P. J. Towers, Dalal Street,
Mumbai-400001
BSE Scrip Code: 530199

Listing Department,
National Stock Exchange of India Ltd.
"Exchange Plaza",
Bandra – Kurla Complex,
Bandra – East, Mumbai- 400 051
NSE Scrip Code: THEMISMED

Dear Sir/Madam,

Sub: Newspaper Publication titled "Notice with respect to Special Window for re-lodgement of transfer requests of physical shares".

Dear Sir / Madam,

Please find attached clippings of the newspaper publication titled "Notice with respect to Special Window for re-lodgement of transfer requests of physical shares", published in today's Financial Express and The Indian Express dated Wednesday, 10th September, 2025. The same are also available on the Company's website at www.themismedicare.com

This is for your information and records.

Thanking you,

Yours faithfully,

For **THEMIS MEDICARE LIMITED**

Pradeep Chandan
Director – Legal, Compliance & Company Secretary

Themis Medicare Limited


Corporate Office: 11/12 Udyog Nagar, S V Road, Goregaon (W), Mumbai – 400 104, India

***Tel.:** 91-22-67607080 ***Fax:** 91-22-67607070/ 28746621

Regd. Office: Plot No. 69-A, G.I.D.C., Industrial Estate, Vapi-Gujarat

CIN No.: L24110GJ1969PLC001590 ***Tel/ Fax No.:** **Regd. Off.:** 0260-2431447/ 2430219

***E-mail:** themis@themismedicare.com ***Website:** www.themismedicare.com



भारतीय कंटेनर निगम लिमिटेड
CONTAINER CORPORATION OF INDIA LTD.
एक नवतन्त्र कम्पनी (भारत सरकार का उपक्रम)
A Navratna Company (A Govt. of India Undertaking)
NSIC New MIDP Building, 2nd Floor, Okhla Industrial Estate Opp. NSIC Okhla Metro Station, New Delhi-110020


NOTICE INVITING TENDER (NIT)

CONCOR invites E-bid Open Tender in two packets system of tendering for Operation & Maintenance of Equipments and Cargo Handling at Reefer Park, ICD Dadri, details as follows:

S.No.	Bid Reference	Tender No.	CON/ICD/DER/T/REFPARK/0&M/2025
1.	Bid Security (Earnest Money) Deposit	Rs. 5,00,000/-	
2.	Cost of Document (Non-refundable)	Rs 1000/-	through online payment gateway to CONCOR
3.	Tender processing fee (Non-refundable)	Rs 3540/-	(Including GST @18%) Through online payment gateway to CONCOR
4.	Pre-Bid Meeting	16th September 2025 11:00 hrs.	at Container Corporation of India Ltd. Inland Container Depot Dadri, Vill- Tilpatta, Noida-Dadri Road, Near Dadri Railway Station, Greater Noida, Gautam Budh Nagar, 201311.
5.	Period of Tender Sale (online)	10th September 2025 at 15:00 hrs. to 30th September 2025 at 16:00 hrs.	
6.	Date and time of Submission of Bid	01st October 2025 at 11:00 hrs.	
7.	Date and time of opening of Bid	01st October 2025 at 12:00 hrs.	

CONCOR reserves the right to reject any or all the tenders without assigning any reasons thereof. For complete details log on to www.tenderwizard.com/CCIL.

Group General Manager/Technical (Area-1)



ON LINE TENDERING
ROAD & BUILDING DEPARTMENT
TENDER NOTICE NO. 18 OF 2025-26

In the name and on behalf of the Governor of Gujarat State, the Executive Engineer, R & B Division, Civil Lines Road, B/H Blood Bank, Godhra-389001 Dist. PMS. Ph. No (02672) 243421 invites on line tenders for One Road work and One Building work in SBD form having cost Rs.642.92 lacs to Rs.4211.20 lacs from the Contractors registered in appropriate category.

The Bid document for works will be available on web site <https://rnb.nprocure.com>. up to Dt.8.10.25 up to 12:00 Hrs. & last date of online tender submission Dt.8.10.25 up to 18:00 Hrs. Contractor should submit the all bid documents by RPAD on or before from Dt.8.10.25 to 15.10.25 during office hours.

For further particulars please visit above website or contact this office during office hours.

INFO-GODHRA-504-25



Rajkot Nagarik Sahakari Bank Ltd.

Symbolic Possession Notice
(For Immovable Property)

R.O. & H.O.: 'Arvindbhai Maniar Nagarik Sevalay', 150' Ring Road, Near Raiya Circle, Rajkot. Ph. 2555555

The undersigned being the authorized officer of Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O. Rajkot under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 Section 13(2) and in exercise of powers conferred under the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice to the below mentioned borrowers and Guarantors advising them to repay their bank dues mentioned in the notice with due interest thereon within **60 days** from the date of notice and as they have failed to repay the amount, notice is hereby given to them and the public in general that the undersigned has taken **Symbolic possession** of the properties described herein below in exercise of powers conferred on him under section 13(4) of SARFAESI ACT-2002, read with **rule 8(1)** of the Security Interest (Enforcement) Rules, 2002 for recovery of the secured debts. Following borrowers and Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with this property will be subject to the charge of Rajkot Nagarik Sahakari Bank Ltd., Rajkot for an amount mentioned below and interest thereon due from **01/09/2025**.

Branch Name & Account No.	Borrower / Guarantor / Director / Partner name & If Bank issue Public notice in News Paper then date & News Paper Details	As per 13(2) Notice Outstanding Amount & Notice date	Date of Symbolic Possession	Outstanding Amount As on 31/08/2025
Bhuj 049014106000354 (SEC/5090)	BORROWER(S) : Pathan Panjabken Gulabkhan (Legal Heirs of Pathan Gulabkhan Ismailkhan) GUARANTOR(S) : (1) Goswami Janardan Nirmalgiri (2) Khatri Abdulla Umar "FINANCIAL EXPRESS" and "DIVYA BHASKAR" DATE 13/06/2025	Rs. 3,61,865=25 (As on 30/04/2025) 13(2) Notice Date: 31/05/2025	06/09/2025	Rs. 3,76,719=26

Mortgage Properties Description

Immovable Property situated in Gujarat State, Dist. Kutch, Sub Dist. Bhuj, in the centre of Bhuj City Revenue Survey No.264 Area Known as "Kalyaneshwar Wadi" N.A. Plot No.1 and 2, Thereon Constructed Apartment Known as "Sunrise", On Fourth Floor, Block No.C, Wing No.1 Flat Admeasuring Area 62-45 Sq. Meter acquired Vide Regd. Sale deed No.5355 Dated 03/06/2014 in the Name of Gulabkhan Ismailkhan Pathan

Dt. 08/09/2025, Rajkot. Authorized Officer, Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O., Recovery Department, Rajkot.



INDIAN INSTITUTE OF SCIENCE EDUCATION AND RESEARCH PUNE
(An Autonomous Institution of Ministry of Education, Govt. of India)
Dr. Homi Bhabha Road, Pune- 411 008 | Website: www.iiserpune.ac.in

ADVT. NO.: 39/2025
RECRUITMENT FOR REGULAR NON-TEACHING POSITIONS
EXTENSION OF LAST DATE

The Last date for submission of online applications for various non-teaching positions is extended up to **20.09.2025**. Refer Institute website for detailed advertisement.

Date: 09.09.2025 **REGISTRAR**



IKF FINANCE LIMITED
REGISTERED OFFICE : # 40-1-144, Corporate Centre, M.G.Road, Vijayawada-520 010. Phone No.: 0866-2474644.

POSSESSION NOTICE (For immovable property) Rule 8 (1)

Whereas, the undersigned being the Authorized Officer of IKF Finance Limited (IKF) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 19/06/2025 calling upon the borrower/s and co borrower/s 1) Krunal Motors Rep by its Proprietor Dhrupadsinh Thakor, 2) Dhrupadsinh Ukaji Thakor, 3) Rajeshwari Dhrupadsinh Thakor (Loan Account No. LXVDR03323-240261870) to repay the amount mentioned in the notice being Rs. 7,75,015/- (Rupees Seven Lakh Seventy Five Thousand and Fifteen Only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of Security Interest Enforcement rule 2002, on this **5th day of September Month of the year 2025**.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IKF for an amount of **Rs. 7,75,015/- (Rupees Seven Lakh Seventy Five Thousand and Fifteen Only)** as due on **18-June-2025** with further interest and Charges thereon.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, If the borrower clears the dues of the "IKF" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by "IKF" and no further step shall be taken by "IKF" for transfer or sale of the secured assets.

DESCRIPTION OF THE SECURED ASSET (IMMOVABLE PROPERTY)

All that Piece and Parcel of Non-Agriculture Land of Property in Mauje: Bapod, Vadodara, lying being R.S.No. 578, admeasuring 4148.00 Sq. Mtrs., Scheme Known as "SUN RISE SHOPS & FLATS" paiki Saswat Tower Flat No. 403 on Forth Floor, Construction admeasuring 83.20 Sq. Mtrs., at Registration District & Sub-District: Vadodara & District: Vadodara bounded by: **East By** Common Margin Space of Flat, **West By** After Common Passage Flat No. 406 of Saswat Tower, **North By** After O.T.S. & Common Passage Flat No. 401 & 402 of Saswat Tower, **South By** Flat No. 404 of Saswat Tower.

Place: Vadodara
Date: 05-09-2025

Sd/- Authorised Officer,
IKF Finance Limited




Housing and Urban Development Corporation Limited
(A Govt. of India Enterprise)
(An ISO 9001-2015 Certified Company)
2nd Floor, HUDCO Bhawan ,Ishwar Bhuvan Road , Navrangpura, Ahmedabad, Gujarat - 380 009
Phone:079-26580684, CIN :L74899DL1970GOI005276

Housing and Urban Development Corporation Limited (HUDCO Ltd.), a Navratna CPSE intends to construct additional two blocks of Office Building having around 1,11,080 Sqft area at HUDCO Bhawan, Ishwar Bhuvan Road, Navrangpura, Ahmedabad within 18 months. The office space is proposed to be rented out on long term rental basis only to Central/State Govt. Departments / PSUs / Banks / Insurance Companies.

The prospective State/Central agency/ PSUs / Banks / Insurance Companies may submit their Expression of Interest for their requirement of office space. Other relevant information on the Office space is available in our website: www.hudco.org.in. Any further corrigenda to this advertisement will be published only in our website. The last date for submission of EoI is 10.11.2025 (Two months from date of publication of this advt.).

HUDCO Regional Chief, Ahmedabad



THEMIS MEDICARE LIMITED
CIN: L24110GJ1969PLC001590
Regd. Office: Plot no. 69-A, GIDC Industrial Estate, Vagh-396 195, Dist. Valsad, Gujarat, India
Phone No: 91-22-67607080 Fax: 91-22-67607070
Website: <http://www.themismedicare.com> | E-mail : cfoassist@themismedicare.com

Notice to Shareholders
Special Window for Re-lodgment of Transfer Requests of Physical Shares

Securities and Exchange Board of India ("SEBI") vide its circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2nd July, 2025 has introduced a Special window for re-lodgement of transfer requests of physical shares to facilitate ease of doing investment for investors and to secure their rights in the securities purchased by them.

Pursuant to the said Circular, investors who had submitted transfer requests for physical shares prior to 1st April, 2019 (the date from which transfer of securities in physical form was discontinued), and whose requests were rejected or returned due to deficiencies, are now provided an opportunity to re-lodge such transfer requests.

Eligible investors may re-lodge their earlier requests with the Company's Registrar and Share Transfer Agent ("RTA"), MUFG Intime India Private Limited (formerly known as Link Intime India Private Limited) along with requisite documents, if any, during the Special Window period of six (6) months from 7th July, 2025 till 6th January, 2026.

Investors may send the documents to the Company or RTA on any of the address given below:

Themis Medicare Limited Corporate Office: 11/12, Udyog Nagar, S. V. Road, Goregaon (W), Mumbai – 400 104, Maharashtra, India Tel.: 91-22-67607080 Email : cfoassist@themismedicare.com	MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India Private Limited) C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai – 400083. Tel: +91 8108116767 Email: rnt.helpdesk@in.mpm.mufg.com Or raise a service request at: https://web.in.mpm.mufg.com/helpdesk/Service_Request.html
--	---

Investors are hereby informed that pursuant to the said Circular, the securities re-lodged for transfer (including those requests that are pending with the Company/ RTA, as on date) shall only be issued in Demat mode after following due process for transfer / Demat.

We encourage all investors to initiate necessary actions without delay to regularize pending transfer cases.

Your sincerely,
For Themis Medicare Limited
Sd/-
Pradeep Chandan
Director - Legal, Compliance & Company Secretary

Date: 09/09/2025
Place: Mumbai



Rashtrasant Tukadoji Maharaj Nagpur University
DST-PURSE Project, PGTD Chemistry, Amravati Road, Nagpur 440033
www.nagpuruniversity.ac.in

E-TENDER NOTICE

Coordinator, DST-PURSE Project, Rashtrasant Tukadoji Maharaj Nagpur University, Nagpur invites online tenders from the qualified professional firms for the **Supply of Ten (10) Scientific Instruments**.

The names of the instruments and their detailed specifications are available on the University's website www.nagpuruniversity.ac.in. The individual E-Tender application for the same can be downloaded from the government online portal www.mahatenders.gov.in. The qualified firms are encouraged to submit their bids through online portal as per the specifications provided in the documents available on the University's website www.nagpuruniversity.ac.in. The last date to submit the bids is **03/10/2025 till 17:00 hours**. Right to accept or reject any or all tenders without giving any reason is reserved with the university authority.

Registrar **Coordinator, DST-PURSE Project**



TOURISM CORPORATION OF GUJARAT LIMITED (TCGL)
(A Government of Gujarat undertaking)
Block No. 16, 4th Floor, Udyog Bhavan, Sector 11, Gandhinagar, Gujarat - 382011


EXPRESSION OF INTEREST NOTICE

Expression of Interest is invited for **Empanelment of Consulting Agencies and Educational Institutions for undertaking various research related studies / projects for Gujarat Tourism**.

The requirements, eligibility criteria, selection process, etc. are included in the EOI document, which shall be available for download from the websites <https://tender.nprocure.com/> and <https://www.gujarattourism.com> from **10/09/2025 onwards**.

The last date for **online submission** (only for Applicants under Category 1) of the **Technical Bid is 24/09/2025 up to 6:00 pm**, and **physical submission** (for Applicants under both Category 1 & 2) of the **Technical Bid is 26/09/2025 up to 3:00 pm**.

Managing Director



Saurashtra University Rajkot

Tender Notice Advertise No. 08/2025-26

Online Tender is invited from government registered contractors of Gujarat State, Central Government and other states public work department for the work stated below.

Name of Work	Construction of Underground Water Tank (Fire & Domestic) Fire Fighting And Fire Detection Work For Library Building at Saurashtra University, Rajkot
Estimated Cost	Rs. 78,09,009.91
Time Limit	04 Months
Earnest Money Deposit	Rs. 78,091/-
Tender Fee	Rs. 7,080/-
Place where and date and Time to which the tender forms will be will be issued	https://tender.nprocure.com
Download of tender	30/09/2025 16:00
Upload of tender	30/09/2025 18:00
Physical Submission tender (Last Date & Time)	10/10/2025 18:00
when, where and by whom the tenders will be open	https://tender.nprocure.com
Website	www.saurashtrauniversity.edu

Above Mentioned tender can be downloaded from <https://tender.nprocure.com> Tender shall be quoted online by nprocure registered contractor. All tender details are available on above mentioned website.

Registrar



Shri Narendra Modi
Prime Minister of India



Shri Vishnu Deo Sai
Chief Minister of Chhattisgarh



Chhattisgarh
Business Made Easy
— As Easy As —



Govt. of Chhattisgarh

A Click

One Click, Single Window System brings speed, simplicity, and transparency to the business environment. From approvals and clearances to bill payments, land allotment, and incentive disbursal — *everything an entrepreneur needs is now just one click away.*

A Plan

Chhattisgarh Industrial Development Policy 2024–30 offers customized benefits for investments above ₹1,000 Crore or projects creating 1,000+ jobs. With 18+ subsidies and exclusive packages across 9 priority sectors, the policy supports both fixed capital and operational expenses.

A Go

With 4 major airports and direct flights placing key Indian cities just 90–120 minutes from Raipur, seamless access is guaranteed. A power-surplus state with abundant water, 60+ industrial parks, and 50,000+ graduates annually—**Chhattisgarh is business-ready.**

In Chhattisgarh

Ease is not just a promise

It's a system.



Explore More



#CGBusinessEasy

Ahmedabad

Continued from previous page...

Promoters) whose names appear in the register of member of the Target Company as on Tuesday, August 26, 2025, the Identified Date.

xxx. Under Point 4 of Section IX- "Procedure For Acceptance And Settlement Of The Offer" the following point is updated: Persons who have acquired Equity Shares but whose names do not appear in the register of members of the Target Company on the Identified Date i.e., Tuesday, August 26, 2025, the date falling on the 10th Working Day prior to the commencement of Tendering Period, or unregistered owners or those who have acquired Equity Shares after the Identified Date, or those who have not received the Letter of Offer, may also participate in this Open Offer. Accidental omission to send the Letter of Offer to any person to whom the Offer is made or the non-receipt or delayed receipt of the Letter of Offer by any such person will not invalidate the Offer in any way.

yyy. Under Point 5 of para "Procedure for tendering Equity Shares held in Physical form" of Section IX- "Procedure For Acceptance And Settlement Of The Offer" the following point is updated: In case any person has submitted Equity Shares in physical form for dematerialization, such Eligible Shareholders should ensure that the process of getting the Equity Shares dematerialised is completed well in time so that they can participate in the Offer before Offer Closing Date. i.e. Wednesday, September 24, 2025 or else their application will be rejected.

zzz. Under Point No. 1 & 3 of para "Procedure for tendering the Equity Shares in case of non-receipt of Letter of Offer" of Section IX- "Procedure For Acceptance And Settlement Of The Offer" the following point is updated: Eligible Shareholders who have acquired Equity Shares but whose names do not appear in the register of members of the Target Company on the Identified Date i.e. Tuesday, August 26, 2025, or unregistered owners or those who have acquired Equity Shares after the Identified Date, or those who have not received the Letter of Offer, may also participate in this Open Offer.

3. The LOF along with a Form of Acceptance, will be dispatched to all the Public Shareholders of the Target Company (through electronic mode or physical mode), whose names appear in the register of members of the Target Company and to the beneficial owners of the Target Company in dematerialized form or physical form whose names appear on the beneficial records of the respective depositories, in either case, at the close of business hours on the Identified Date i.e. Tuesday, August 26, 2025 to the Offer.

aaaa. Under Section XI-- "Documents For Inspection", the following new point has been inserted in the third paragraph: Following is the Mechanism for Online Inspection of Material Documents:

I. Public shareholders who wish to inspect the documents electronically should send a request from his/her registered email ID to the Manager to the Offer at openoffers@safronadvisor.com, along with their shareholding details (Name, Folio No./DP ID and Client ID) in the Target Company. In the case of a corporate shareholder, an authority letter must also be provided.

II. Upon receiving the request, the Manager to the Open Offer will verify the shareholding details with the Registrar and Share Transfer Agent of the Target Company.

III. Once the verification is complete, a link granting view-only access to the inspection documents will be shared with the eligible shareholder. The view-only access will remain valid throughout the tendering period.

IV. The link will be activated from the opening date of the Offer until its closure.

V. If a request is received from a public shareholder during the tendering period, the access to the documents shall be provided within one working day from the date of receipt of the request.

bbbb. Under Section XI-- Point No 03- "Documents For Inspection", the following point has been updated: Copy of the Networth of Acquirer as on March 31, 2025, as certified through its partner Kriresh Kumar, (Membership No.

543246) by GSTARK & Associates, Chartered Accountants, (Firm Registration Number. 030526N), having office at, Flat No. 101C, 998/100, Sainik Nagar Uttam Nagar Delhi 110059; Email id: cakrtesh@gmail.com; vide certificate dated August 26, 2025, bearing Unique Document Identification Number (UDIN) – 25543246BMMKGB1293.

cccc. Under Section XI-- Point No 04- "Documents For Inspection", the following point has been updated: Copies of Audited Annual reports of the Target Company for the financial years ending March 31, 2024, and March 31, 2023.

dddd. Under Section XI-- Point No 05- "Documents For Inspection", the following point has been updated: Copies of Annual reports of the Acquirer for the financial years ending March 31, 2023 and December 31, 2023 and December 31, 2024 along with copy of RD order copy.

eeee. Under Section XI-- Point No 06- "Documents For Inspection", the following point has been updated: Audited financial statements of Acquirer on a consolidated basis for the quarter ended March 31, 2025 and financial years ended December 31, 2024, and December 31, 2023, and on Standalone basis for the financial years ended March 31, 2023.

ffff. Under Section XI-- Point No 12- "Documents For Inspection", the following point has been updated: Observation letter bearing reference number SEBI/HO/CFD/CFD-RAC-DCR2/P/OW/2025/22892/1 dated August 22, 2025 received from SEBI.

11. Schedule of Major Activities of the Offer:

Sr. No	Activity	Schedule of Activities Day and Date ⁽¹⁾	Revised Schedule (Day and Date) ⁽¹⁾
1	Public Announcement (PA)	Friday, April 04, 2025	Friday, April 04, 2025
2	Publication of DPS in the newspapers	Tuesday, April 15, 2025	Tuesday, April 15, 2025
3	Last date for filing of draft letter of offer with SEBI	Wednesday, April 23, 2025	Wednesday, April 23, 2025
4	Last date for public announcement of competing offer(s) ⁽²⁾	Thursday, May 08, 2025	Thursday, May 08, 2025
5	Last date for receipt of comments from SEBI on Draft Letter of Offer (in the event SEBI has not sought clarifications or additional information from the Manager to the Open Offer)	Friday, May 16, 2025	Friday, August 22, 2025 ⁽³⁾
6	Identified Date ⁽⁴⁾	Tuesday, May 20, 2025	Tuesday, August 26, 2025
7	Last date by which the Letter of Offer to be dispatched to the Public Shareholders whose name appears on the register of members on the Identified Date	Tuesday, May 27, 2025	Wednesday, September 03, 2025
8	Last date for upward revision of the Offer Price and/or Offer Size	Friday, May 30, 2025	Tuesday, September 09, 2025
9	Last Date by which the committee of the independent directors of the Target Company is required to publish its recommendation to the Public Shareholders for this Open Offer	Friday, May 30, 2025	Wednesday, September 10, 2025
10	Date of publication of Offer Opening Public Announcement in the newspapers in which the DPS has been published	Monday, June 02, 2025	Wednesday, September 10, 2025
11	Date of commencement of the Tendering Period ("Offer Opening Date")	Tuesday, June 03, 2025	Thursday, September 11, 2025
12	Date of closure of the Tendering Period ("Offer Closing Date")	Monday, June 16, 2025	Wednesday, September 24, 2025

13	Last date of communicating the rejection/acceptance and completion of payment of consideration or return of Equity Shares to the Public Shareholders of the Target Company	Monday, June 30, 2025	Thursday, October 09, 2025
14	Last date for publication of Post Open Offer Public Announcement in the newspapers in which the DPS has been published	Monday, 07 July, 2025	Thursday, October 16, 2025

Notes:

- Where last dates are mentioned for certain activities, such activities may take place on or before the respective last dates.
- There is no compelling offer to this Offer.
- The actual date of receipt of SEBI observations on the DLOF.
- The Identified Date is only for the purpose of determining the Public Shareholders as on such date to whom the Letter of Offer would be sent in accordance with the SEBI (SAST) Regulations, 2011. It is clarified that all the Public Shareholders equity shareholders of the Target Company (registered or unregistered) (except the Acquirer and the Promoter of the Target Company) are eligible to participate in this Offer at any time prior to the closure of the Tendering Period.
- The Acquirer accepts the full and final responsibility for the information contained in the PA, DPS and the LOF also for the obligations of the Acquirer laid down in the SEBI (SAST) Regulations, 2011 in respect of this Offer.
- This Offer Opening Public Announcement would also be available on the website of SEBI at www.sebi.gov.in and on the website of Manager to the Offer at www.safronadvisor.com

ISSUED BY THE MANAGER TO THE OFFER ON BEHALF OF THE ACQUIRER

SAFFRON
***** *energising ideas* *****

SAFFRON CAPITAL ADVISORS PRIVATE LIMITED
6005, Sixth Floor, Centre Point, Andheri-Kurla Road, J. B. Nagar, Andheri (East), Mumbai-400 059, Maharashtra, India.
Tel. No.: +91 22 49730394; **Email id:** openoffers@safronadvisor.com; **Website:** www.safronadvisor.com
Investor Grievance ID: investorgrievance@safronadvisor.com
SEBI Registration Number: INM 000011211
Validity: Permanent
Contact Person: Yashi Srivastava/Chirag Singhal

REGISTRAR TO THE OPEN OFFER

**CAMEO CORPORATE SERVICES LIMITED**
Subramanian Building, 5th/Floor, No. 1, Club House Road, Chennai –600 002, India
Tel. No.: +91-44-4002 0700; **Email id:** priva@cameoindia.com
Investor Grievance email id: investor@cameoindia.com
SEBI Registration No.: INR000003753
Validity: Permanent
Contact Person: Sreepriya K

Place: New Delhi
Date: September 09, 2025

SWARAJ
SWARAJ ENGINES LTD.
CIN: L50210PB1985PLC006473
Regd. Office: Phase IV, Industrial Area, S.A.S. Nagar (Mohali), Punjab – 160055, Tel : 0172–2271620, Fax : 0172–2272731
E-mail: selinvestor@swarajenterprise.com
Website: www.swarajenterprise.com

NOTICE

100 Days Campaign – “Saksham Niveshak” – For KYC And Other Related Update and shareholder engagement to prevent Transfer of Unpaid / Unclaimed dividends to Investor Education and Protection Fund (“IEPF”)
Notice is hereby given to the Shareholders of Swaraj Engines Limited (“your Company”) that pursuant to Investor Education and Protection Fund Authority (“IEPFA”), Ministry of Corporate Affairs (“MCA”) letter dated 16th July, 2025, your Company has started a 100 days campaign “Saksham Niveshak” starting from 28th July, 2025 to 6th November, 2025. During this campaign all the shareholders who have not claimed their dividends or have not updated their KYC & nomination details or face any issues related to unclaimed dividends and shares may write to the Company’s Registrar and Transfer Agent (“RTA”) i.e. M/s MCS Share Transfer Agent Limited, at email ID helpdeskdelhi@mcsmcsregistrars.com, or at their office at 179-180, DSIDC Shed, 3rd Floor, Okhla Industrial Area, Phase - I, New Delhi – 110020 or the Company at email ID selinvestor@swarajenterprise.com.
The shareholders may further note that this campaign has been started proactively and specifically to reach out to the shareholders to update their KYC, Bank Mandates, Nominee and contact information, etc. and claim their unpaid/unclaimed dividend in order to prevent their shares and dividend amount from being transferred to the IEPFA.

For **SWARAJ ENGINES LIMITED**

Sd/-
Rajesh K. Kapila
Company Secretary
M.No.: ACS-9936

Place : S.A.S.Nagar (Mohali)
Date : 09.09.2025

**KALYANI INVESTMENT COMPANY LIMITED**
CIN : L65993PN2009PLC134196
Regd. Office : Mundhwa, Pune – 411 036, Maharashtra, India
Tel No. : +91-020-66215000
Email : investor@kalyani-investment.com Website : www.kalyani-investment.com

REMINDER - I TO SHAREHOLDERS REGARDING OPENING OF SPECIAL WINDOW FOR RE-LODGE/MENT OF TRANSFER REQUESTS OF PHYSICALS SHARES

In continuation to our previous advertisement dated July 10, 2025 and pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CI/R/2025/97 dated July 2, 2025, all shareholders are hereby once again informed that a special window has been opened only for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of April 1, 2019 and rejected / returned / not attended, due to deficiency in the documents / process otherwise. The re-lodgement window shall remain open for a period of six months i.e. from July 7, 2025 till January 6, 2026.


Eligible shareholders are requested to contact the Company's Registrar and Transfer Agent (RTA), MUFG Intime India Private Limited at email ID pune@in.mpmcs.mufg.com or at their office at Block No.202, Akshay Complex, 2nd Floor, Off Dhole Patil Road, Near Ganesh Mandir, Pune 411 001 or the Company at investor@kalyani-investment.com for further assistance.

During this period, the securities that are re-lodged for transfer (including those requests that are pending with the Company / RTA, as on date) shall be issued only in demat mode, once all the documents are found in order by RTA. The lodger must have demat account and provide its Client Master List (“CML”), along with the transfer documents and share certificates, while re-lodging the documents for transfer with RTA.

For Kalyani Investment Company Limited

Nihal Gupta
Company Secretary & Compliance Officer

Place : Pune
Date : September 9, 2025

**THEMIS MEDICARE LIMITED**
CIN: L24110GJ1969PLC001590
Regd. Office, Plot no. 69-A, GIDC Industrial Estate, Vapi-396 195, Dist. Valsad, Gujarat, India
Phone No: 91-22-67607080 Fax: 91-22-67607070
Website: <http://www.themismedicare.com> | E-Mail : cfoassist@themismedicare.com

Notice to Shareholders
Special Window for Re-lodgment of Transfer Requests of Physical Shares

Securities and Exchange Board of India ("SEBI") vide its circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CI/R/2025/97 dated 2nd July, 2025 has introduced a Special window for re-lodgement of transfer requests of physical shares to facilitate ease of doing investment for investors and to secure their rights in the securities purchased by them.

Pursuant to the said Circular, investors who had submitted transfer requests for physical shares prior to 1st April, 2019 (the date from which transfer of securities in physical form was discontinued), and whose requests were rejected or returned due to deficiencies, are now provided an opportunity to re-lodge such transfer requests.

Eligible investors may re-lodge their earlier requests with the Company's Registrar and Share Transfer Agent ("RTA"), MUFG Intime India Private Limited (formerly known as Link Intime India Private Limited) along with requisite documents, if any, during the Special Window period of six (6) months from 7th July, 2025 till 6th January, 2026.

Investors may send the documents to the Company or RTA on any of the address given below:

Themis Medicare Limited Corporate Office: 11/12, Udyog Nagar, S. V. Road, Goregaon (W), Mumbai – 400 104, Maharashtra, India Tel.: 91-22-67607080 Email : cfoassist@themismedicare.com	MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India Private Limited) C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai – 400083. Tel: +918108116767 Email: mt.helpdesk@in.mpmcs.mufg.com Or raise a service request at: https://web.in.mpmcs.mufg.com/helpdesk/Service_Request.html
--	--


Investors are hereby informed that pursuant to the said Circular, the securities re-lodged for transfer (including those requests that are pending with the Company/ RTA, as on date) shall only be issued in Demat mode after following due process for transfer / Demat.

We encourage all investors to initiate necessary actions without delay to regularize pending transfer cases.

For sincerely,
For Themis Medicare Limited

Sd/-
Pradeep Chandan
Director - Legal, Compliance & Company Secretary


Date: 09/09/2025
Place: Mumbai

**Regaal Resources Limited**
CIN: U15100WB2012PLC171600
Registered Office: 6th Floor, D/2/2, Block - EP & GP, Sector V, Salt Lake, Kolkata - 700091, West Bengal
Ph:033 35222405 E-mail: cs@regaal.in Website: www.regaalresources.com

Extract of Unaudited Standalone Financial Results for the Quarter ended June 30, 2025
(Rs. in Millions except Earnings per Share)

Particulars	Quarter ended			Year ended 31st March, 2025
	30th June 2025	31st March 2025	30th June 2024	
	Unaudited	Audited	Audited	Audited
Total Income from Operation	2,468.26	2,599.87	1,953.56	9,175.76
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	120.62	146.02	122.83	637.99
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	120.62	146.02	122.83	637.99
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	90.67	111.81	91.75	476.68
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)]	90.66	112.54	91.49	478.26
Equity Share Capital	410.68	410.68	383.41	410.68
Other Equity				2,024.40
Earnings per equity share (of ₹ 5/- each)				
(a) Basic	1.10	1.35	1.20	6.05
(b) Diluted	1.09	1.34	1.20	6.03

Note: The above is an extract of detailed format of unaudited standalone Financial Results for the quarter ended June 30, 2025 filed with Stock Exchanges under regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of unaudited standalone quarterly Financial Results are available on the Stock Exchange Websites (www.bseindia.com & www.nseindia.com) and Company's Website (www.regaalresources.com). The same can be accessed by the scanning the Quick Response Code provided below:



For and on behalf of Board of Directors

Regaal Resources Limited
Anil Kishorepuria
(Chairman & Managing Director)
DIN: 00724328

Place: Kolkata
Date: 09.09.2025

નામદાર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અમદાવાદ બેન્ચ સમક્ષ
કંપની પીટીશન નં. સીપી (સીએએ) નં.૧૫/એએચએમ /૨૦૨૫
સાથે જોડાયેલ કંપની અરજી (સીએએ) નં.૪૩/એએચએમ/ ૨૦૨૪

કંપની એક્ટ, ૨૦૧૩ ની બાબતમાં

અને

કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૨૩૦ થી ૨૩૨ અને અન્ય લાગુ જોગવાઈઓ અને તેના હેઠળ ઘડવામાં આવતા નિયમોના સંદર્ભમાં

અને

કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૨૩૦ થી ૨૩૨ હેઠળ (“સ્કીમ”) ગોળવણ ચોજનાને મંજૂરી આપવામાં આવી છે.

એસકોન પિટ્ટીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૧-એસકોન), એવલોન સીરામીક પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૨-એવલોન), કચુરાકોન પિટ્ટીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૩- કચુરાકોન), એરાકોન પિટ્ટીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૪- એરાકોન), અને આઇકોન ગ્રેનાઇટી પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની - આઇકોન), અને તેમના સંબંધિત શેરધારકો અને કેડીટરો વચ્ચેની વ્યવસ્થાની બાબતમાં;

જાહેર ઘોષણા : જોડાણ ચોજનાને મંજૂરી આપવામાં આવેલ છે

આથી સુચના આપવામાં આવે છે કે નામદાર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (માનનીય NCLT), અમદાવાદ બેન્ચ દ્વારા ૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ આપવામાં આવેલ આદેશ અનુસાર એસકોન પિટ્ટીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૧-એસકોન), એવલોન સીરામીક પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૨-એવલોન), કચુરાકોન પિટ્ટીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૩- કચુરાકોન), એરાકોન પિટ્ટીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની ૪- એરાકોન), અને આઇકોન ગ્રેનાઇટી પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની - આઇકોન), અને તેમના સંબંધિત શેરધારકો અને કેડીટરો વચ્ચે કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૨૩૦ થી ૨૩૨ હેઠળ (“સ્કીમ”) ગોળવણ ચોજનાને મંજૂરી આપવામાં આવી છે.

ચોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે :

- ચોજના ની નિયુક્ત તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪ છે.
- ચારેય ટ્રાન્સફરર કંપનીઓની બધી મિલકતો, જવાબદારીઓ અને ઉપક્રમો નિયુક્ત તારીખથી ટ્રાન્સફરર કંપની - આઇકોન ગ્રેનાઇટી પ્રાઇવેટ લીમીટેડમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
- પુસ્તક મૂલ્યોની સાતત્યતા સુનિશ્ચિત કરીને, લાગુ પડતી ગણતરીઓ હેઠળ નિર્ધારિત હિત-જુથ પધ્ધતી હેઠળ જોડાણનો હિસાબ લેવામાં આવશે.
- ટ્રાન્સફરર કંપની - ICON દ્વારા અથવા તેની પિરુદ્ધ કાનૂની કાર્યવાહી તે જ રીતે અને તે જ હદ સુધી ચાલુ રાખવામાં આવશે, કાર્યવાહી અને અમલ કરવામાં આવશે, જે રીતે ટ્રાન્સફરર કંપનીઓ દ્વારા અથવા તેની પિરુદ્ધ ચાલુ રાખવામાં આવી હોય, જાણે કે આ ચોજના બનાવવામાં આવી ન હોય અને ટ્રાન્સફરર કંપનીના તમામ હાલના કરારો, ડીડ, બોન્ડ અને એગ્રીમેન્ટ અમલમાં રહેશે અને લાગુ કરવામાં આવશે અને ટ્રાન્સફરર કંપની દ્વારા અથવા તેની પિરુદ્ધ લાગુ કરવામાં આવશે.
- ટ્રાન્સફરર કંપનીના બધા કર્મચારીઓ ચોજનાની સાતત્યતા જાળવી રાખીને કોઇપણ સેવામાં પિરામ અથવા લાભ ગુમાવ્યા પિના ટ્રાન્સફરર કંપનીના કર્મચારી બનશે.
- ટ્રાન્સફરર કંપની ચોજનામાં ઉત્તેજ કરવામાં આવેલ શેર પિનીમય ગુણોત્તર અનુસાર, ચારેય ટ્રાન્સફરર કંપનીઓના શેરધારકોને ઇક્વિટી શેર જારી કરશે.

આ ચોજના ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજથી અમલમાં આવી છે. જયારે કંપનીના રજીસ્ટ્રાર, ગુજરાત દાદરા અને નગર હવેલીમાં ઉપરોક્ત આદેશની પ્રમાણિત નકલ ફાઇલ કરવામાં આવી છે.

હિસ્તેદારો, કેડીટરો અને સભ્યોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા અને વધુ વિગતો માટે ટ્રાન્સફરર કંપનીના રજીસ્ટર્ડ ઓફિસમાં ઉપલબ્ધ ચોજના અને આદેશની નોંધ લેવા જણાવવામાં આવે છે.


આઇકોન ગ્રેનાઇટી પ્રાઇવેટ લીમીટેડ વતી

સહી/-

પંકજ દેવરાજભાઈ સરોડીયા
ડિરેક્ટર
DIN : 01669154

તારીખ : ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫

સ્થળ : મોરબી

**યૂનિયન બેંક**
of India
A Member of the Union Bank Group

એસેટ રીકવરી શાખા, અમદાવાદ,
વહી માળ, સેગેલી કોમ્પ્લેક્સ,
વી એસ હોસ્પિટલ સામે, આશ્રમ રોડ,
એલીક્ટ્રીકીય, અમદાવાદ-૩૮૦૦૦૬

સ્થાવર મિલકતોના વેચાણ માટે (૧૫ દિવસ) વેચાણ નોટીસ

સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (૬) / ૯ (૧) ની જોગવાઈઓ સાથે યંચતા સિક્યોરીટીદારોને અને રીકવરરકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-દરજી વેચાણ નોટીસ

ઈ-દરજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૫ (શુક્રવાર) બપોરે ૧૨:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાકે

ખાસ કરીને દેવાદાર/રો અને જામીનદાર/રો અને જાહેર જનતાને આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતો સિક્કોટ લેણદારને ગીરો/ચાર્જ કરાવેલ છે, જેના અવસર કબજો સુનિયમ બેંક ઓફ ઇન્ડિયા, સિક્કોટ લેણદારના અધિકૃત અધિકારીએ લઈ લીધો છે, જેનું “વચ્ચા છે”, “જે છે” અને “જમ છે” ના હોરોએ નીચે જણાવેલ નીચે જણાવેલ દેવાદાર અને જામીનદારો પાસેથી સુનિયમ બેંક ઓફ ઇન્ડિયા, સિક્કોટ લેણદારની નીચે જણાવેલ બાકી રકમની વસુલત માટે નીચે જણાવેલ તારીખોએ વેચાણમાં આવશે. રીઝર્વ કિંમત અને સર્ગસ્ત મની ડિપોઝીટ નીચે મુજબ રહેશે.

દેવાદાર/સહ-અમદાર અને જામીનદાર/રોનું નામ	મિલકતનું વર્ણન	બાકી રકમ	રિઝર્વ કિંમત અને ઈએમકી અને ડિડ વૃદ્ધિ
શ્રીમતી નિરસી એમ પંડ્યા (દેવાદાર) શ્રી મણલાલનિરામ વિરાગ શાહ	સ્થાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ જેનો યુનિટ નં. ૫૦૩, બ્લોક નં. ૬, બિન ખેતી લાયક જમીનો સર્વે નં. ૫૬૮/૨ અને ૫૬૮/૩નું લેખનં ૦-૩૩-૮૬ ચો.મી. જે સરખાનું રહેલ નામે બાણીલી સ્કીમનો ફ્લેટ નં. ૬/૫૦૩, (પાંચ ઈ)નું લેખનં ૧૬૮૮-૮૬ ચો. ફૂટ બિલ્ટ અપ એરિયા (૧૩૩.૩૬ ચો.મી.) પાંચમો માળ, કરમસ્ટ, તાલુકો અને જુલો આહાંદ. મિલકત પરના બાજની વિગતો, સિક્કોટ લેણદારની બાજમાં હોય તેવા, બે કોઇ હોય તો: નથી. (અવસર કબજો)	રૂ. ૪૩,૧૫,૯૮૧.૬૫ (રૂપિયા તેલલીસ લાખ અગિયાર હજાર સાતસો એકસાંચી અને પાંચ પેસા પુરા) તા. ૩૦.૦૬.૨૦૨૫ મુજબ અને તા. ૦૧.૦૭.૨૦૨૫ થી કરારના દરે આગામી વ્યાજ અને ખર્ચ	રીઝર્વ કિંમત : રૂ. ૩૨,૪૦,૦૦૦.૦૦ (રૂપિયા બીસ લાખ ચાલીસ હજાર પુરા) ઈએમકી : રૂ. ૩,૨૨,૧૦૦/- (રૂપિયા ત્રણ લાખ એવીસ હજાર પાંચસો પુરા) ડિડ વૃદ્ધિ : રૂ. ૩૩,૦૦૦.૦૦
મેસર્સ ઘનશ્યામ ઈન્ડસ્ટ્રીઝ (દેવાદાર) શ્રી સ્વપ્નિકાંત અરવિંદભાઈ ગમ્પર (ગોપરાધર અને ગીરવેદાર)	સ્થાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ અવિભાજિત હિસ્સા સાથે ફિ હોલ એન.એ. જમીન પરના બાંધકામનો ફ્લેટ નં. ૭, ચોથો માળ (મંજૂર બિલ્ડીંગના લેખન નં. ૫૦૩) નામે બાણીલી સ્કીમનો ફ્લેટ નં. ૭/૫૦૩, (પાંચ ઈ)નું લેખનં ૧૬૮૮-૮૬ ચો. ફૂટ બિલ્ટ અપ એરિયા (૧૩૩.૩૬ ચો.મી.) પાંચમો માળ, કરમસ્ટ, તાલુકો અને જુલો આહાંદ. મિલકત પરના બાજની વિગતો, સિક્કોટ લેણદારની બાજમાં હોય તેવા, બે કોઇ હોય તો: નથી. (અવસર કબજો)	રૂ. ૩,૯૫,૬૬,૩૮૯.૯૬ (રૂપિયા ત્રણ કરોડ પંચાસી લાખ છાસ હજાર ગણસો નેચારી અને બેસતી પેસા પુરા) તા. ૩૦.૦૬.૨૦૨૫ મુજબ અને તા. ૦૧.૦૭.૨૦૨૫ થી કરારના દરે આગામી વ્યાજ અને ખર્ચ	રીઝર્વ કિંમત : રૂ. ૧,૦૦,૮૫,૦૦૦.૦૦ (રૂપિયા એક કરોડ પંચાસી હજાર પુરા) ઈએમકી : રૂ. ૧,૧૨,૧૦૦/- (રૂપિયા દસ લાખ આઠ હજાર પાંચસો પુરા) ડિડ વૃદ્ધિ : રૂ. ૧,૦૦,૦૦૦.૦૦
શ્રી સિદ્ધાંત એસ. બહાબર (દેવાદાર) શ્રી સિદ્ધાંત એસ. બહાબર	સ્થાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ બેલોન પ્લોટ નં. ૬/૧૮૪, કર્મચીર સુરેન્દ્રનાગ, ૩, કર્મચીર સુરેન્દ્રનાગ-૧ પાસે, પ્રભુ કુટીર સામે, મંજુપુરા રોડ, નડિયાદ, ગુજરાત, પોટ એરિયા -૮૦૭ ચો. ફૂટ, જેની ચતુર્સીમા નીચે મુજબ છે. ઉત્તર : પોટ નં. ૬/૧૮૪, દક્ષિણ:પોટ નં. ૬/૧૮૫, પૂર્વ :પોટ નં. ૬/૨૦૦, પશ્ચિમ:એમોય રોડ. મિલકત પ		